Date: 04th September, 2023 Reference: Symbol: ACCORD

To, **National Stock Exchange of India Limited** Exchange Plaza, Plot No. C/1, G Block BandraKurla Complex, Bandra (East)

Mumbai- 400051, Maharashtra

Sub: Newspaper Publication of Notice of the 09thAnnual General Meeting

Dear Sir/Ma'am,

As per Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, this is to inform you that 09th Annual General Meeting of the Company will be held on Friday, 29thSeptember, 2023at 1:30 p.m.through Video Conferencing(VC)/ Other Audio Visual Means(OAVM) facility and notice of the same has been published in newspaper named Business Standard and Loksatta on Friday, 01st September, 2023.

This is for your information and record.

Kindly acknowledge the receipt of the same.

Thanking You Yours Faithfully

For Accord Synergy Limited

Sd/-Kirti Bhavesh Chauhan Company Secretary & Compliance Officer

NILA INFRASTRUCTURES LIMITED

(CIN: L45201GJ1990PLC013417)

Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bunglow, Bodakdev, Ahmedabad - 380 015.

Phone: +91 79 4003 6817/ 18 Fax: +91 7926873922 E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

NOTICE OF 33RD ANNUAL GENERAL MEETING TO THE SHAREHOLDERS

NOTICE IS HEREBY GIVEN THAT THE 33RD ANNUAL GENERAL MEETING ("THE AGM") OF THE COMPANY WILL BE HELD ON FRIDAY, SEPTEMBER 29, 2023 AT 11.30 A.M. THROUGH VIDEO CONFERENCING ("VC")/ OTHER AUDIO-VISUAL MEANS ("OAVM") TO TRANSACT THE BUSINESSES AS MAY BE SET OUT IN THE NOTICE OF THE AGM.

The Government of India, Ministry of Corporate Affairs ("MCA"), vide its Circular No. 14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020 followed by Circular No. 20/2020 dated May 05, 2020 and Circular 02/2021 dated January 13, 2021 and also Securities Exchange board of India ("SEBI"), vide it's Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2, CIR/P/2021/11 dated January 15, 2021 ("Circulars") and clarification dated May 05, 2022 & December 28, 2022 have permitted the holding of AGM through VC/OAVM, without the physical attendance of the Members at a common venue. In compliance with these Circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, the AGM of the Members of the Company will be held through VC or OAVM.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company, Depositories holding shares as on the cut-off date for the dispatch in accordance with the applicable laws Members may note that the Notice of the AGM and Annual Report 2022-23 will also be available on the Company's website- www.nilainfra.com, website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited, at www.bseindia.com and www.nseindia.com respectively and the AGM Notice is also available on the website of National Securities Depository Limited (NSDL) (agency for providing the Remote e-Voting facility) i.e. www.evoting.nsdl.com. Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/ OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes or all resolutions as set out in the Notice of the AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). The detailed procedure for remote e-voting/ e-voting are provided in the Notice of the AGM.

In case Member(s) have not registered their e-mail addresses with the Company/ Depository, please follow the below instructions to register e-mail address for obtaining Annual Report and login details for e-voting.

- a. For members holding shares in Physical mode: please provide necessary details like Folio No./ DP/ Client ID, Certificate No., PAN, Mobile No., Email-Id along with the self-attested copy of PAN/ Aadhar/ Valid Passport/ Share Certificate, etc. by e-mail to secretarial@nilainfra.com
- Members holding shares in Demat Mode: can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by e-mail to secretarial@nilainfra.com

Date: September 01, 2023 Place: Ahmedabad

For, NILA INFRASTRUCTURES LIMITED By Order of Board of Directors Dipen Parikh-Company Secretary



NILA SPACES LIMITED

(CIN: L45100GJ2000PLC083204)

Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bunglow, Bodakdev, Ahmedabad - 380 015.

Phone: +91 79 4003 6817/18 Fax: +91 7930126371

E-mail: secretarial@nilaspaces.com Website: www.nilaspaces.com

NOTICE OF 23RD ANNUAL GENERAL MEETING TO THE SHAREHOLDERS

NOTICE IS HEREBY GIVEN THAT THE $23^{ ext{RD}}$ annual general meeting ("The AGM") of the company will be HELD ON WEDNESDAY, SEPTEMBER 27, 2023 AT 04.00 P.M. THROUGH VIDEO CONFERENCING ("VC")/ OTHER AUDIO-VISUAL MEANS ("OAVM") TO TRANSACT THE BUSINESSES AS MAY BE SET OUT IN THE NOTICE OF THE

The Government of India, Ministry of Corporate Affairs ("MCA"), vide its Circular No. 14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020 followed by Circular No. 20/2020 dated May 05, 2020 and Circular 02/2021 dated January 13, 2021 and also Securities Exchange board of India ("SEBI"), vide it's Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2, CIR/P/2021/11 dated January 15, 2021 ("Circulars") and clarification dated May 05, 2022 & December 28, 2022 have permitted the holding of AGM through VC/OAVM, without the physical attendance of the Members at a common venue. In compliance with these Circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, the AGM of the Members of the Company will be held through VC or OAVM.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company, Depositories holding shares as on the cut-off date for the dispatch in accordance with the applicable laws Members may note that the Notice of the AGM and Annual Report 2022-23 will also be available on the Company's website- www.nilaspaces.com, website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited, at www.bseindia.com and www.nseindia.com respectively and the AGM Notice is also available on the website of National Securities Depository Limited (NSDL) (agency for providing the Remote e-Voting facility) i.e. www.evoting.nsdl.com. Members can attend and participate in the AGN through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/ OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of the AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). The detailed procedure for remote e-voting/ e-voting are provided in the Notice of the AGM.

In case Member(s) have not registered their e-mail addresses with the Company/ Depository, please follow the below instructions to register e-mail address for obtaining Annual Report and login details for e-voting.

For members holding shares in Physical mode: please provide necessary details like Folio No./ DP/ Client ID, Certificate No., PAN, Mobile No., Email-Id along with the self-attested copy of PAN/ Aadhar/ Valid Passport/ Share Certificate, etc. by e-mail to secretarial@nilaspaces.com

Members holding shares in Demat Mode: can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by e-mail to secretarial@nilaspaces.com

Date: September 01, 2023 Place: Ahmedabad

For. Nila Spaces Limited By Order of Board of Directors Gopi Dave-Company Secretary





EBSCO TRAINING SESSION ON NEW RESEARCH DEVELOPMENT

IBS Ahmedabad had an enlightening guest access to peer-reviewed studies, amplifying navigation, covering adept search strategies through quality training sessions. and result refinement. The insights ventured beyond the mechanics of the platform. Emphasizing the transformative power of research, the expert highlighted how EBSCO's resources could grant students

session as part of the Library Week, their academic pursuits. His guidance coordinating an EBSCO training on new illuminated a path to harnessing knowledge, research development. Guided by the demonstrating how research enriches expertise of Gorakshanath Upadhyaya, a comprehension and contributes to achieving seasoned specialist, the event unraveled the success. Beyond the lecture's confines, the potential of the EBSCO platform for significance of EBSCO in academia was research. With a clear and enthusiastic profoundly emphasized. This session approach, the session engaged attendees in underscored IBS Ahmedabad's commitment intricacies of effective platform to enhancing students' academic growth



INDUCTION CEREMONY OF INTEGRATED BBA-MBA BATCH 2023-28 AT IMNU

Programme, Institute, and University, and provide exposure to industry experts. This year, students were provided insights on a multitude of areas such as out-of-the-box thinking, issues and challenges around sustainable tourism, and design thinking addressed by dignitaries and spokespersons like Mr Mohit Mangal, Dr Harald Friedl, and

The Institute of Management, Nirma Mr Yash Rathi, respectively. This was University, organised the induction followed by several cultural events and ceremony of the Integrated BBA-MBA Batch informational sessions. IMNU welcomed the 2023-28 from 7th - 11th August 2023. The students with the intention of introducing and Induction Programme aims to introduce the aligning the vision and values of the incoming students to various aspects of the institution and steering the students towards their upcoming academic endeavors.

Campus Reporter - Arya Vaghela



EMPOWERING MINDS AND SHAPING FUTURES: INSIGHTS FROM GANPAT UNIVERSITY MBA ORIENTATION 2023-25

decision-making. Prof. Daniel Montplaisir personal branding, offering a framework for celebrating graduates' accomplishments. navigating the business world. Dr Anita Basalingappa highlighted the nuances of strategic marketing, emphasising informed decisions and effective strategies. Major Parthivsinh G. Vaghela stressed character, aspirations, and planning, urging graduates

Ganpat University - Faculty of Management to confront fear courageously and remain Studies organised the MBA orientation consistent. Dr Adarsh Vinay of P&G for the 2023-25 batch, a celebration of underscored the value of critical thinking, wisdom and inspiration. Distinguished communication, and emotional intelligence. speakers from various fields shared insights Dr Parth Shah, Co-founder of DevX with the new graduates. Dr Hiren J Patel and Accelerator, shared his entrepreneurial Dr Mahendra Sharma welcomed attendees, journey, focusing on persistence and the emphasising ethics and discernment in power of the law of attraction. Prof. Yashpalsinh Jadeja delivered a vote of discussed competition, strategy, and thanks, expressing gratitude to speakers and

Campus Reporter - Varun Solanki



PUBLIC NOTICE

Main Road Bangalore- 560068 Branch Office: ICICI Bank Ltd. 4/10, Mythree Tower, Bommanhalli Hosur

The following borrower/s have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). A notice was issued to them under Section 13 (2) of Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act-2002 on their last known addresses, however it was not served and

Sr No	Name of the Borrower/ Co-Borrower/ Guarantor/ (Loan Account Number) & Address	Property Address of Secured Asset/ Asset to be Enforced	Date of Notice Sent/ Outsta- nding as on Date of Notice	NPA Date
1.	Parmeshwar/ Sudha/ Nisarga Badavane Hatalgeri Road Gadag Karnataka Gadag- 582101/ LBGDG00005330360	Description of The Property: All That Piece And Parcel Residential Plot Bearing No: 12, E-swattu No: 29-5-924-1216 Measuring East- West: 9 Mtrs North-south: (06.40+7.50)/2 le., 62.55 Sq Mtrs, Which Is Consisting R.C.C Building Measuring 48.309 Sq Mtrs Comprised In Survey No: 274k Situated Within The Limits of Town Municipal Council, Gadag-Betageri, Ward No: 29, Gadag- Village, Tq: & Dist: Gadag. Boundaries of Said Plot Are As Under: Towards East: 9 Mtrs Road. Towards West: Survey No: 274/b. Towards North: Plot No: 11. Towards South: Survey No: 275	17/07/2023 Rs. 19,59,016/-	06/05/ 2023

The steps are being taken for substituted service of notice. The above borrower/s and/or their guarantors (as applicable) are advised to make the payments of outstanding within period of 60 days from the date of publication of this notice else further steps will be taken as per the provisions of Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. Date: September 01, 2023 Authorized Officer

OSBI State Bank of India

Stressed Assets Management Branch-1, Mumbai (04107), The Arcade, 2nd floor, World Trade Centre, Cuffe Parade, Colaba, Mumbai – 400 005, e-mail-team4.04107@sbi.co.in 022-22160929

Anotice is hereby given that the following Borrower/s M/s Renex Industries Pvt. Ltd. (Formerly Known As M/s Swathi Sunsource Power Private Ltd.) (Borrower) and M/s Unisource Synergies Private Limited (Corporate Guarantor) and Mr. Premraj Pamadhi Chalavaraj, Mr. Ravi Banarasilal Kapoor, Mr. Ashish Bipinkumar Soni, Mr. Samir Shabbir Kapadia, Mr. Pahelaj Satyapal Badlani (Personal Guarantors) have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). The notices were issued to them under Section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act 20(2) on their last known addresses but they have been refurred Assets and Enforcement of Security Interest Act 2002 on their last known addresses, but they have been returned unserved and as such they are hereby informed by way of this public notice.

Borrower	betails of the properties/ Address of the Secured Assets to be Emorced
M/s Renex Industries Pvt Ltd (Formerly known as	1 Hypothecation of stocks & receivables and Hypothecation of Plant & Machinery, situated at the factory premises, Industrial Park Penukonda, Village- Penukonda, District-Anantapur, Pin-515 110, Andhra Pradesh
M/s Swathi Sunsource Power Private Ltd.) Add:- Office No. 112.	2 Flat 101, First Floor, Sumit Pramukh Enclave Co-op Housing Society Ltd., CTS 379, 379/1 to 53, Bachhani Nagar Road, Malad East, Mumbai, 400097 (Maharashtra) Total admeasuring area 98.15 sq. mt. (with one car parking area of 13.95 sq mt) Owned by Mr. Pahelai Satyapal Badlani (Guarantor)
Arun Bazar, S.V. Road, Malad (W), Mumbai- 400 064	3 Flat no B-601, 6th Floor of building no. 'B", Mulberry Heights, Constructed on the land bearing Revenue Survey no 33/6, Village-Bhatpor, Taluka-Choryasi, District-Surat. Pin-395003 (Gujarat) Total admeasuring area 104.51 sq. mt. Super Buildup Owned by Mr. Ravi B. Kapoor and Mr. Samir S. Kapadia (Guarantor)
	4 All that piece and parcel of Industrial land bearing Survey Numbers: - 85-1, 85-2, 87, 86-1, 72-2, 72-3 and 85-4 together with building thereon situated at Industrial Park Penukonda, Village-Penukonda, District-Anantapur, Pin—515 110, Andhra Pradesh, (Total area admeasuring 45.17 acres) Owned by M/s Renex Industries Pvt Ltd (formerly known as M/s Swathi Sunsquirce Power Private Ltd.) [horrowerl

contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges, etc The steps are being taken for substituted service of notice. The above Borrower(s) and /or their Guarantor(s) (wheneve applicable) are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under sub-section (4) of Section 13 of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002.

Amount outstanding (As on the date of notice)

Rs. 22,82,27,983 (Rupees Twenty-Two Crore Eighty-Two Lac Twenty Seven Thousand Nine

Hundred Eighty-three only) as on 09.08.2023. You are also liable to pay future interest at the

The borrower's & Gaurantor's attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect o ime available to redeem the secured assets

Date: - 30.08.2023, Place :- Mumbai Authorised Office State Bank Of India



HINDUJA HOUSING FINANCE

Date of Notice Date Of NPA

09.08.2023

Corporate Office: No. 27/A, Developed Industrial Estate, Guindy, Chennai, Tamilnadu-600032,

Branch Office: 3rd, Floor, IFFCO Bhavan, B/h. Maruti Complex, B/h. Pintoo Garment, Nr. Shivranjani Cross Road, Satellite, Ahmedabad-380015. Authorised Officer: Mr. Saurabhkumar Napit

DEMAND NOTICE

E-mail: saurabhkumar@hindujahousingfinance.com

Physical Possession Notice - As per Appendix IV

Whereas, The undersigned being the Authorized Officer of Hinduja Housing Finance Limited (HHFL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued the Demand Notice under section 13(2) calling upon the borrowers to repay the amount mentioned in the notice alongwith further charges, interest etc. within 60 days from the date of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the said Act read with Rule 8 of the Security interest Enforcement Rules, 2002.

Name of Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date & Amount Loan Account No & Branch	Date & Type of Possession	SCHDULE OF THE PROPERTY
BORROWER: MR. RAMESH TANWAR	Dt. 26/10/2022 & Rs. 12,39,860/- & A/C No. GJ/AMD/GDNR/A00000003	27-08-2023 Physical	All that part and parcel of non-agriculture immovable Residential Flat No. F/6 admeasuring construction 40.94 sq. mtrs with undivided rights in the land of the
CO-BORROWER: MRS.KAMLABEN TANWAR	Ω.	Possession	
co-operative Housing society Ltd", situated on the land of sub Plot No.788,789,792,889,890,898 of Revenue survey No. 205., 247 and 248 of Mouje/village: Saijpur Bogha, sub Dist. and District - Ahmedabad, Gujarat,			

Bounded by: East- Common open space then House, West- Flat No. F/5, North Common Open Space then Flat, South-Flat No F/5

BORROWER: MR. ASHISH KACHHADIYA	Dt. 03/08/2022 & Rs.48,96,476/- & A/C No.	27-08-2023	Residential Property bearing Bunglow No. 39 (admeasuring about 1699 Sq. Fts. & Construction thereon 2302 Sq. Fts.), in the
CO-BORROWER: MR. MAYUR KACHHADIYA	GJ/AMD/AHMD/A000000054 & GJ/AMD/AHMD/A000000377	Physical Possession	scheme known as "Sant Villa", Situated at Survey No. 187, Mouje: Manjipura, Taluka: Nadiad, Dist. & Sub District: Kheda.
The borrower's attention is invited to provisions of sub –section (8) of section 13 of the Act, in respect of time			

cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of HHFL. Place: GUJARAT Authorized officer Date: 01-09-2023 For, Hinduja Housing Finance Limited



ACCORD SYNERGY L

CIN No. L45200GJ2014PLC079847

Regd Off:302 Shine Plaza, Natubhai Circle, Race Course, Vadodara - 390007 Phone: (0265) 2356800 Fax: (0265) 2356800 Website: www.accordsynergy.com Email: info@accordsynergy.com

NOTICE OF 9TH ANNUAL GENERAL MEETING TO BE HELD OVER VIDEO CONFERENCE, E-VOTING, RECORD DATE AND OTHER INFORMATION

NOTICE is hereby given that the ninth Annual General Meeting of the members of ACCORD SYNERGY LIMITED (Company) will be held on Friday, the 29th day of September, 2023 at 1:30 P.M. (IST). Pursuant to circular no.10/2022 dated December 28, 2022 in furtherance of its earlier circular no. 02/2021 dated January 13, 2021 read together with circulars dated April 8, 2020, April 13, 2020, May 5,2020 and May 5,2022 (collectively referred to as "MCA Circulars") issued by the Ministry of Corporate Affairs, the AGM is being held through Video Conference (VC)/ Other Audio Visual Means(OAVM) facility being provided by National Securities Depositories Limited (NSDL), to transact the business as set out in the notice of AGM The instructions for joining the AGM electronically is provided in the Notice of AGM Pursuant to the MCA Circulars mentioned above and SEBI Circular SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62

dated 13th May, 2022, read with Circular SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and Circular SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020; members may kindly note that the AGM Notice for the year ended 31st March, 2023 is being sent electronically, only to such members whose E-mail Id is registered with the Company's Registrar / Depository Participant (DP). Those members who have not registered their E mail Id may kindly register with their DP or RTA Link In Time www.linkintime.co.in

Notice is also given under Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules 2014 that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Saturday, 23rd September, 2023 to Thursday, 28th September, 2023 (both days inclusive) for the purpose of the AGM.

The Company will provide its Members, facility of remote e-voting, through electronic voting services provided by NSDL for casting votes on all the business items as set out in the Notice of AGM. Members holding shares and recorded in register of members or in the register of beneficial owners maintained by depositories as on the cut off date i.e. Thursday, September 21, 2023, shall be entitled to e-voting. The remote e-voting shall commence on Tuesday, September 26, 2023 at 09.00 a.m. (IST) and end on Thursday, September 28, 2023 at 05.00 p.m.(IST). The e-voting will be disabled thereafter. Any person who acquire shares of the Company and becomes member after dispatch of the AGM Notice and holding shares as on cutoff date may obtain the user ID and password by sending request to evoting@nsdl.co.in. or if already registered with NSDL for e-voting then existing user ID and password can be used for casting vote.

Facility for e voting will also be provided at the AGM to only those members who attend the AGM through VC/OAVM and have not cast their vote. The notice of the AGM and Annual Report is also available at the website of the Company www.accordsynergy.com, at the website of Stock Exchange www.nseindia.com and at the website of NSDL at www.evoting.nsdl.com. In case of any queries relating to e-voting, members may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request to NSDL at evoting@nsdl.co.in. For Accord Synergy Limited

Place: Vadodara Kirti Bhavesh Chauhan Date: 1" September, 2023



MADHYA PRADESH TOURISM **BOARD (MPTB)**

CIN: U75302MP2017NPL043078

6th Floor, Lily Trade Wing, Jahangirabad, Bhopal Tel.: (0755) 2780600, www.tourism.mp.gov.in NIT No.: 5619/PUB/MPTB/2023

SYSTEM No. 2023 MPTB 303541 1st September, 2023

'EOI for Empanelment of State Level Agencies for Marketing Campaign, Creative and Printing Services'

MPTB invites offers for "EOI for Empanelment of State Level Agencies for Marketing Campaign, Creative and Printing Services". Terms and Conditions can be downloaded from website www.tourism.mp.gov.in and https://www. mptenders.gov.in. For any other information, Contact +91-9407057416 or E-mail at cs.mptb@mp.gov.in Last date for online submission of EOI is 25.09.2023, 15:00 hrs. M.P. Madhyam/111753/2023 **MANAGING DIRECTOR**

NOTICE

IN THE COURT OF MOTOR ACCIDENT CLAIMS TRIBUNAL (AUXI) NAVSARI, DIST NAVSARI (GUJARAT STATE)

Motor Accident Claim Case No. 149/2018 Fixed On. 29/09/2023

APPLICANT: VAISHALIBEN PRAVINBHAL TANDEL & OTHERS VERSUS OPPONENT (1) JAGPRASAD RAMDULAR VERMA

RESI AT: MUMRA PANVEL ROAD, KALYAN FATA, ABHAY NAGAR KAILASH APPARTMENT, ROOM NO 206, THIRD FLOOR,

MAHARASHTRA STATE PERMANENT ADDRESS: AANAD BHAVAN, SECOND FLOOR, R/202, KEV ROAD, CHICH BANDAR, MUMBAI-400000.

The aforesaid opponent (1) is hereby informed that the above said applicant have filed this case against you, under Sec. 166 of Motor Vehicle Act. 1939 for recovery of compensation to the fine of Rs. 1,10,00,000/- the copy present in person in this Tribunal 29/09/2023 at 11.00 a.m. for filing your reply of the claim case. You are also hereby informed to remain present on this date with all your written documents apon which you rely. You are hereby given this notice that if you will not remain present on

Prepared By, (Sign/-) A.V. Gandhavi) Assistant

Compered By, (Sign/-) OF (N.S.Parmar) COURT Bench Cleark

Chequed By, (Sign/-) (P.P.Patel) Dv. Ragistrar M.A.C.T. (MAIN) Branch Navsari, Dist. Navsari

Exh. No. 08

Applicant

DEBTS RECOVERY TRIBUNAL-I (Ministry of Finance, Government of India) 2nd Floor, Bhikhubhai Chambers, Nr. Kocharab Ashram, Paldi, Ashram Road, Ahmedabad - 380006

Established u/s, 3 of the Recovery of Debts due to Banks & Financial Institutions Act, 1993 for the area comprising Districts of Ahmedabad, Gandhinagar, Mehsana, Patan, Sabarkantha (Himmat Nagar) Banaskantha (Palanpur) of Gujarat State w.e.f. 1st June, 2007.)

Outward No. 596/2023 O. A. No. 82/2022 Central Bank of India

Versus

Mr. Kishan Laxmichand Sharma & Ors. Defendant

PUBLIC SUMMONS

1. Mr. Kishan Laxmichand Sharma 230/2/1, 2nd & 3rd Floor, Shakti Sagar Complex, Nr. Raipur Gate BRTS Bus Stand, Khadia, Ward-02, Ahmedabad-380001.

2. Mrs. Guddi Kishan Sharma 230/2/1, 2nd & 3rd Floor, Shakti Sagar Complex, Nr. Raipur Gate

BRTS Bus Stand, Khadia, Ward-02, Ahmedabad-380001. . Whereas the above named Applicant/Appellant has filed the above referred application/appeal in this Tribunal

2. Whereas the service of Summons could not be affected in the ordinary manner and whereas the application for substituted service has been allowed by this Tribunal.

3. You are directed to appear before this Tribunal in person or through an Advocate and file Written Statement/say on 13.10.2023 at 10.30 A.M. and show cause as. to why reliefs prayed for should not be granted.

4. Take Notice that, in default of, the Application/Appeal shall be heard and decided in your absence.

Given under my hand and seal of this Tribunal on this 22nd day of June, 2023 at Ahmedabad.





(Under Rule 8(6) r/w Rule 9(1) of the Security Interest (Enforcement) Rules 2002 E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) r/w Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002 Loan Account No. TCFLA0216000010960051 (Primary Loan Account No. 7000377)

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY

Mr. Anandbhai M Sakariya Notice is hereby given to the public in general and in particular to the below Borrower/ Co- Borrowe hat the below described immovable property mortgaged to Tata Capital Financial Services Ltd (Secured Creditor/TCFSL), the Possession of which has been taken by the Authorised Officer of Tata Capital Financial Services Ltd. (Secured Creditor), will be sold on 25th Day of September, 2023 "As is where is basis" & "As is what is and whatever there is & without recourse basis".

hereas the sale of secured asset is to be made to recover the secured debt and whereas there was wheleas hie Sale Ose Secured assets to be hade to leave in leave the secured each wheleas there was a due of a sum Rs. 1,43,83,187/- (Rupees One Crore Forty Three Lakh(s) Eighty Three Thousand One Hundred Eighty Seven Only) vide Loan Account No. TCFLA0216000010960051 (Primary Loan Account No. 7000377) as on 27.01.2022 demanded vide Notice U/s. 13(2) dated 27th January 2022 from Borrowers/Co-Borrowers, I.e., (1) Mr. Anandbhai Mohanbhai Sakariya, (2) Mrs. Manjuben Anandbhai Sakariya, (3) Mr. Bhavin Anandkumar Sakariya, (4) Mr. Jayesh nandkumar Sakariva. (5) M/s. Yagna Gems, Through its Proprietor Mr. Bhavin Anandkum Anandkumar Sakariya, (s) M/s. Yagna Gems, Infougn its Proprietor Mr. Bhavin Anandkumar Sakariya All 1 to 5 having add at: Plot No. -F, Swastik Apartment, 2nd Floor, Shakti Nagar Society, Opp. People's Char Rasta, Katargam Road, Surat, Gujrat 395004, Also Add At: 70A, Vasanji Park Society, Near Kantareshwar Mandir, Katargam, Surat, Gujrat 395004.

Notice is hereby given that, in the absence of any postponement/ discontinuance of the sale, the said property shall be sold by E- Auction at 2.00 P.M. on the said 25th Day of September, 2023 by TCFSL.

ving its branch office at Office No 501/502/503/504, 5th Floor, Reegus Business Center, Nev City Light Road, Surat - 395007.

he sealed E- Auction for the purchase of the property along with EMD Demand Draft shall be eceived by the Authorized Officer of the TATA CAPITAL FINANCIAL SERVICES LTD till 5.00 P.M. or the said 23rd Day of September, 2023.

Description of Secured Asset	Possession Constructive/ Physical	(Rs.)	EMD (Rs)
All that rights title and interest in Non Agriculture Property bearing Revenue Survey No. 137, T. P. Scheme No. 49, F. P. No. 141, Paiki "Vasanji Park Co-Operative Housing Society Limited", Paiki Plot No. 42, (New No. 70-A), Total Area Admeasuring 110.99 Sq. Mtrs. Of Katargam at Taluka Choriyashi & Dist Surat. The Boundaries of the Property are as follows: North: Shaktinagar Society; South: Adjoining Plot No. 70; East: Society Road; West: Adjoining Plot No. 64 and Shaktinagar Vadi.	Physical	Rs. 1,01,20,000/- (Rupees One Crore One Lakh(s) Twenty Thousand Only)	(Rupees Ten

he description of the property that will be put up for sale is in the Schedule. Moyable articles/House old inventory if any lying inside and within secured asset as described above shall not be available fo sale along with secured asset until and unless specifically described in auction sale notice. The sale will also be stopped if, amount due as aforesaid, interest and costs (including the cost of the sale) are endered to the 'Authorized Officer' or proof is given to his satisfaction that the amount of such secured debt, interest and costs has been paid. At the sale, the public generally is invited to submit their tende ersonally. No officer or other person, having any duty to perform in connection with this sale shall owever, directly or indirectly bid for, acquire or attempt to acquire any interest in the property sold he sale shall be subject to the rules/conditions prescribed under the SARFAESI Act. 2002. The E ction will take place through portal https://disposalhub.com on 25th Day of September, 2023 etween 2.00 PM to 3.00 PM with unlimited extension of 10 minutes each. All the Bids submitted for the purchase of the property shall be accompanied by Earnest Money as mentioned above by way of a Demand Draft favoring the "TATA CAPITAL FINANCIAL SERVICES LTD." payable at **Surat**. rspection of the property may be done on 16th September, 2023 between 11.00 AM to 5.00 PM. e: The intending bidders may contact the Authorized Officer Mr. Harangad Bhogal and Mr

Anurodh Julius.. Email id harangad.bhogal@tatacapital.com/anurodh.julius@tatacapital.cor and Mobile No. +91 8291901835 / 8657439008. For detailed terms and conditions of the Sale, please refer to the link provided in secured creditor?

ebsite, i.e., https://bit.ly/3qPUhmZ or contact Authorized Officer or Service Provider- NexXer Sd/- Authorized Officer Place : - Surat, Date : 01.09.2023 Tata Capital Financial Services Ltd.

Company Secretary

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ ક્રૂડ તેલમાં રૂ. ૯૦ની વૃદ્ધિ



મુંબઈ,તા.૩૧ અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ક્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં ૨,૪૫,૩૯૪ સોદાઓમાં હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કુલ રૂ.૨૦,૨૩૭.૫૨ કરોડનું કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧૨૦ ટર્નઓવર નોંધાયું હતું, જેમાં વધી રૂ.૪૮,૦૨૦ અને ગોલ્ડ-પ કોમોડિટી વાયદાનાં કામકાજનો ેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ હિસ્સો રૂ.પ,૧૩૧.૧ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો હોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.૧૫૦૯૫.૧૭ કરોડનો હતો.

એમસીએક્સ પર ૪૨.૬૦૬ સોદાઓમાં સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં

ગ્રામદીઠ રૂ.પ૯,૪૯૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૫૯,૫૩૯ અને નીચામાં રૂ.૫૯,૪૦૫ ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૪૨ વધી રૂ.૫૯,૫૨૦ના ભાવે પહોંચ્યો રૂ.૪ ઘટી રૂ.૫,૮૯૨ના ભાવે ૫ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨ વધી કીમતી ધાતુઓના વાયદાઓમાં રૂ.૫૯,૧૫૯ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી

સોદાઓમાં રૂ.,૭૭૫.૭ કરોડના સોદાઓમાં

ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.૨૭૮ ઘટી મિની ઓગસ્ટ વાયદો રૂ.૧.૮૦ ઘટી રૂ.૭૪,૧૮૮ બોલાઈ રહૃાો હતો. રૂ.૨૧૭.૨૦ બોલાઈ રહૃાો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ખાતે ૭,૨૧૪ એમસીએક્સ પર ૩૪,૩૬૧ 3.9,320.33

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.૫,૧૩૧ કરોડ અને ઓપ્શન્સમાં રૂ.૧૫૦૯૫ કરોડનું ટર્નઓવર બલડેક્સ વાયદામાં રૂ. ૧૧ કરોડનાં કામકાજ

વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ

વાયદો રૂ.૭૪૨.૮૦ના ભાવે ખૂલી, સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૧.૪૫ વધી રૂ.૭૩૬.૮૦ જ્યારે ૧ બેરલદીઠ રૂ.૬,૭૪૪ના ભાવે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ખૂલી, દિવસ દરમિયાન ઉપ રૂ.ર.૮૦ વધી રૂ.૨૦૧.૩૦ તેમ જ રમાં રૂ.૬,૮૧૨ અને નીચામાં રૂ.૨,૯૬૨.૫૪ કરોડનાં કામકાજ ૧ કિલોદીઠ રૂ.૭૪,૫૯૨ના સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.૦.૨૫ રૂ.૬,૭૩૯ ના મથાળે અથડાઈ, થયાં હતાં. સોનાના વાયદાઓમાં ભાવે ખૂલી, દિવસ દરમિયાન વધી રૂ.૧૮૬ના ભાવ થયા હતા. પ્રથમ સત્ર સુધીમાં રૂ.૭૦ વધી એમસીએક્સ સોનું ઓક્ટોબર ઉપરમાં ર્ગ.૭૪,૫૯૩ અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.૧.૩૫ રૂ.૬,૮૦૫ બોલાયો હતો, જ્યારે કરોડનાં ૧,૮૯૪.૫૮૯ વાયદો સત્રની શરૂઆતમાં ૧૦ નીચામાં રૂ.૭૪,૧૫૫ ના મથાળે ઘટી રૂ.૨૧૬ના ભાવ થયા હતા. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો કિલો અને ચાદીના વિવિધ

વાયદો ૧ એમએમબીટીયુદીઠ ાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો પ.૭ વધી ૨૩૪.૩ બોલાઈ રહૃાો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.૧૨.૫૩ કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં ૧ ખાંડીદીઠ રૂ.૬૦,૦૦૦ના ભાવે ખૂલી, દિવસ દેરમિયાન ઉપરમાં રૂ.૬૦,૩૬૦ ટેન સીસુ અને સીસુ-મિની અનુસાર અને નીચામાં રૂ.૬૦,૦૦૦ ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.૬૦ ઘટી રૂ.૬૦,૨૨૦ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૧૩.૪૦ ઘટી રૂ.૧,૦૦૧.૪૦ બોલાયો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદામાં રૂ.૪.૬૨ કરોડનાં ૭૬૮ વાયદાઓમાં રૂ.૧,૧૨૭.૫૫

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.૬૧પ.૬૪ કરોડનાં ૯૦૮,૪૩૦ બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.૭૬૪.૬૯ કરોડનાં માટેની છેલ્લી ૩૨,૩૫૫,૭૫૦ એમએમબીટીયૂ તારીખ ૩૧ નાં કામ થયાં હતાં. બિનલોહ ઓગસ્ટ ૨૦૨૩ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને છે. સ્ટેટ બેંક એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં ઓફ ઈન્ડિયાની રૂ.૧૨૯.૩૨ કરોડનાં ૬,૪૧૪ વેબસાઈટ વાયદાઓમાં રૂ.૨૧.૯૬ કરોડનાં પ્રોસેસિંગ ફી ૧,૧૮૦ ટન તાંબાના વાયદાઓમાં પર ૫૦ થી ૧૦૦ ટકા ડિસ્કાઉન્ટ તો ડિસ્કાઉન્ટ વિના વ્યાજ ૯.૧૫% રૂ.૪૩૯.૦૯ કરોડનાં ૫,૯૭૩ ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.૧૮૫.૩૩ કરોડનાં ફ્લેક્સીપે, NRĬ અને નોન-સેલેરી તે જ સમયે, ૬૫૦ - ૬૯૯ CIBIL ૮,૫૪૬ ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.૭.૯૧ કરોડનાં ૭૭.૦૪ ટનનાં કામકાજ

લોન પર પ્રોસેસિંગ ફીની માફી

મોંઘવારી વચ્ચે SBI આપી રહી છે સસ્તી હોમ લોન

ઓછા વ્યાજે હોમ લોન આપી છે. ગ્રાહકો પાસે ઓછા વ્યાજે હોમ લોન કન્સેશન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ग्राहडोने सस्ता हरे હોમ લોન આપી રહી છે, વ્યાજમાં છૂટની સાથે, તે પ્રોસેસિંગ ચાર્જિસમાં પણ રિબેટ ઓફર કરે છે

આપવામાં આવી રહ્યું છે. આ છે અને ૪૫ bps ડિસ્કાઉન્ટ પછી ડિસ્કાઉન્ટ રેગ્યુલર હોમ લોન, અસરકારક વ્યાજ દર ૮.૭૦% છે. હોમ લોન પર આપવામાં આવી સ્કોર પર ૦.૩૦ ટકાની વ્યાજ છૂટ રહ્યું છે. બેંક અનુસાર, તમામ HAL આપવામાં આવી રહી છે, જેના પછી અને ટોપ અપ વર્ઝન માટે કાર્ડ રેટમાં નવો દર ૯.૧૫ ટકા થશે, જ્યારે ૫૦ ટકા (લોન રકમના ૦.૩૫ ટકા ૫૫૦ - ૬૪૯ વચ્ચેના CIBIL ગણા ૫૦ ટકા)ની છૂટ આપવામાં સ્કોર પર, લોન ૯.૬૫ ટકાના રિબેટ આવી છે અને આ છૂટે ૩૧ ઓગસ્ટ પર ઉપલબ્ધ થશે.

૨૦૨૩ સુધી રહેશે. આ સિવાય ભારતની સૌથી મોટી જાહેર GSTમાં પણ છૂટ આપવામાં ક્ષેત્રની બેંક SBIએ તેના ગ્રાહકોને આવશે. ટેકઓવર, રેસેલ અને રેડી ટુ મૂવ હોમ પર ૧૦૦% પ્રોસેસિંગ ફી માફી આપવામાં આવશે. જો લોન કન્સેશન લેવાની આજની કે, ઇન્સ્ટા હોમ ટોપ અપ, રિવર્સ તક છે. જો તમે પણ SBI પાસેથી મોર્ટગેજ અને EMD માટે કોઈ છૂટ હોમ લોન લેવા માંગો છો, તો નથી. આના પર લોનની રકમના તમે હોમ લોનના વ્યાજ પર ૫૫ ૦.૩૫% પ્રોસેસિંગ ફી વસૂલવામાં bps સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી આવશે. આના પર GST પણ લાગુ શકો છો. પ્રોસેસિંગ ફી અને હોમ 🛮 થશે અને તેના પર ઓછામાં ઓછો

૨,૦૦૦ રૂપિયા વત્તા અને વધુમાં વધુ 90,000 રૂપિયા વત્તા GST લાગશે. જો CIBIL સ્કોર 940-600 અને તેથી વધુ છે,

નાંદોદના ધારાસભ્ય ખેડુતોની વ્હારે: ૧૦ કલાક વીજળી આપવા સરકારને પત્ર

મો.સા ઉપરનો કાબુ ગુમાવી દઇ સામેથી

આવતી મોટર સાયકલ ને અકસ્માત કરી

દેતા ચાલક પ્રવીણભાઇ નરસિંહભાઇ

વસાવાને ઉવ.આ ૩૩ (રહે- કેવડી

આશ્રમ ફળીયુ તા- ઉમરપાડા જી-

ખેડુતોને ખેતીનો ઉભા પાક બચાવવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે ગુજરાત સરકારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ૧૪ જીલ્લાઓમાં વીજ જોડાણમાં ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કરી ઊભો પાક બચાવવામાં મદદ કરી છે.ત્યારે આદીવાસી બહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાનો આમા સમાવેશ ન કરતાં અન્યાયને પગલે નર્મદા જિલ્લાના ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

યુવતીને મામાંનાં ઘરે જવાનીનાં ડેડીચાપાડાની શંભુનગર ચોક્ડી નજીક પાડતા ઝેરી દવા પી લેતા મોત

રાજપીપળા,તા.૩૧ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામમાં નજીવી

બાબતે યુવતીએ ઝેરી દવા પી લેતા મોત થયું હતું. વિગતો અનુસાર પ્રાપ્ત ધર્મિષ્ઠાબેન

હસમુખભાઇ બારીયાએ (ઉં.વ-૧૮ રહે,પોઇચા તા.નાંદોદ જી.નર્મદા) તા.૨૯/ ૦૮/૨૦૨૩ ના રોજ મામાના વસાવાએ (રહે.કેવડી આશ્રમ ફળીયુ, કરતા સારવાર દરમિયાન મોત થયું હતું. ઘરે વનમાલા,ફતેપુર ખાતે જવાનું તા- ઉમરપાડા જી- સુરત) આપેલી તેમજ અલતાબ હાજીભાઇ શેખને (રહે-જણાવતા તેણીના માતા-પિતાએ ફારયાદ મુજબ આક્ટવા માં.સા.ના ઉમરપાડા બજાર ફળીયા તા- ઉમરપાડા રક્ષાબંધનનો તહેવાર હોવાથી ચાલક શૈલેશભાઇ ભીખાભાઇ તડવી જી-સુરત) ઇજા પહોંચાડી તથા પોતાને જવાની ના પાડી હતી.

તો તેણીને ખોટુ લાગતા ડેડીયાપાડા જી- નર્મદા) મો.સાં.માચ અંજનાબેન રણજીતભાઇ વસાવાને રાત્રીના આશરે બે વાગ્યાના અરસામાં ઘરમાં પડેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા રસોડામાં જઇને પી લેતા તેને સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પિટલ ખાતે લાવતા મૃત જાહેર કરતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

भा३ नाभ બદામ આરમા મોહસીન હતુ બદલીને બદામ અસ્મા મોહસીન રાખેલ છે. પાસપોર્ટ નં. એલરકહરહ૩૨. નદીપાર ગોન્દ્રા, ઇદગાહ મોહલ્લા, ગોધરા, પંચમહાલ.

भा३ नाभ શેખ ફરઝાના મોહમદ હન્નામ હતુ બદલીને પટેલ ફરજાનાબીબી અબ્દુલહન્નાન રાખેલ છે. ફાતમા નગર, ઉસ્માનીયા સોસા, લુણાવાડા.

જરાવાલા ઝાહેદા શોકતઅલી હતુ બદલીને જરદાવાલા ઝાહેદા શોકતઅલી રાખેલ છે. પાસપોર્ટ નં. કેટ૬૩૪७૫૮, સાતપુલ સોસા., મદરસા પાસે,

> Change of Name Birth Date

, SMT Jasumati Spouse of No. 14405870L Ex-HAV Parmar Suresh Bhai Resident of Vill. Rajgadh. Ta: Dhrangadhra, Dist: Surendranagar, Post: Haripar Pin: 363310 Have Changed my Name From Jasumati To Parmar Jasuben & Changed Date Of Birth From 01/03/1974 To 23/06/1975 Vide Affidavit Date. 28/08/2023 Sworn Before S.A. JADAV (Notary Vadodara).

અગાઉ કમોસમી વરસાદ વરસ્યો હતો હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ત્યારે નર્મદા જિલ્લામાં નુકશાનીનું સર્વે દર્શનાબેન દેશમુખ જિલ્લાના ખેડૂતોની વ્હારે માટે ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજળી પણ કરવામાં આવ્યું હતું, પરંતું નર્મદા આવ્યા છે.મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો આપવા વિનંતી છે.ત્યારે હવે ડો.દર્શનાબેન જિલ્લાના ખેડુતોને એ નુકશાનીનું વળતર છે જેમાં જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદ દેશમુખની રજુઆતને પગલે સરકાર નર્મદા હજુ સુધી મળ્યું નથી ત્યારે ૨ કલાક ખેંચવાના કારણે નર્મદા જિલ્લાના ખેડૂતોને જિલ્લાને વધુ વીજળી આપશે એવી આશા વધુ વીજળી આપવાના નિર્ણયમાં નર્મદા મુખ્ય પાક કેળા, કપાસ, શેરડી સહિતના બંધાઈ છે. જિલ્લાનો સમાવેશ ન કરી ગુજરાત સરકારે પાકોમાં વધુ જિલ્લાના ખેડુતોને પડતા પર પાટું મારવાનું પાણી જોઈતું કામ કર્યું હોવાનુ પણ ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે.સરકારના નિર્ણય બાદ નર્મદા જિલ્લામાં નુકશાન થઈ ખેડુતોને ખેતીના પાકમાં નુકશાન થતું જ રહ્યું છે.જેથી નથી, શું નર્મદા જિલ્લામાં ખેડુતો છે જ નહિ ન મ દા

બે વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં

એકનું મોત : જ્યારે ત્રણને ઇજા થઇ

થઇ છે.રાજેશભાઇ નરસિંગભાઇ સુરત) માથાના ભાગે ગંભીર ઇજા

(રહે- ચીકદા આંબા ફળીયુ તા- માથાના ભાગે ઇજા પહોંચાડી તેમજ

ચોકડી થઈને શંભુનગર ત્રણ રસ્તા તરફ માથા ના ભાગે ઇજા પહોચાડી ગુનો

આવતા દેવીપાડા ગામ નજીક રોડ ઉપર કરતા ડેડીયાપાડા પોલીસે એક્ટિંવા

જાહેર નિવિદા નં. – ૧૪/૨૦૨૩-૨૪

જણાવવાનુંકે, કેવડીયા વિભાગમાં <mark>"Rate Invite Tender fo</mark>i

Supply of Cactus/Succulent Species of plants for

Kevadia Division, Ektanagar." કામગીરીઓ માટેના ભાવો

મંગાવવામાં આવે છે. આથી રસ ધરાવતી સંસ્થા/ઇજારદાર/

વ્યકિઓએ (n) Procure (www.nprocure.com) સાઇટ પર જાહેરાત

પ્રસિધ્ધ થયેથી દિન-૧૪ માં તેમનો ભાવો ઓન લાઇન આપવા વિનંતી

સંપન્ન ઉત્પાદન ઇન્ડિયા લિમિટેડ

CIN: L40106GJ2010PLC091880

(અગાઉ એસ. ઈ. પાવર લિમિટેડ તરીકે જાણીતી)

રજી. ઓફીસઃ સર્વે નં. ૫૪/બી, પ્રતાપનગર, જરોદ-સાવલી રોક, સમલાચા, વકોદરા-૩૯૧૫૨૦ (ગુજરાત) ટેલીઃ +૯૧ રકકળ ૨૫૧૫કક ● ઇ–મેલઃ cs@sepower.in | Web: www.sepower.in

૧૩ મી વાર્ષિક સામાન્ય સભા અંગેની માહિતી

કંપની અધિનિયમ, ૨૦૧૩ અને તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમોનાં લાગુ પ્રાવધાનો અને સેબી (લિસ્ટિંગ જવાબદારીઓ અને ડિસ્ક્લોઝર જરૂરિયાતો) નિયમો, ૨૦૧૫, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અર્ફર્સ ના તારીખ એપ્રિલ ૮, ૨૦૨૦, એપ્રિલ ૧૩, ૨૦૨૦, મે ૫, ૨૦૨૦, મે ૫, ૨૦૨૨ અને કિસેમ્બર ૨૮, ૨૦૨૨ ના સર્ક્યુલર્સ

(MCA સક્યુંલર) અને તિકચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ એક ઇન્ડિયા દ્વારા ૧૩ મે, ૨૦૨૨, ૫ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ જારી કરવામાં આવેલા સક્યુંલર (સેબી સર્ક્યુલર) અને અન્ય લાગુ પરિપત્રો ની

કંપનીની ૧૩મી વાર્ષિક સાધારણ સભા શુકવાર, તારીખ ર૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્ચે વીડિયો કોન્ફરન્સિંગ ('વીસી')/અન્ય ઓડિયો વિઝ્યુઅલ સાધનો ('ઓએવીએમ') મારફતે, સામાન્ય સ્થળે સભ્યોની ભૌતિક હાજરી સિવાય ૧૩મી એજીએમની નોટિસમાં જણાવ્યા મુજબનો કારોબાર (બીઝનેસ) કરવા વીસી / ઓએવીએમ સુવિધા મારફતે ભાગ લેનારા સભ્યોની

ઉપરોક્ત એમસીએ સરક્યલર અને સેબીના પરિપત્રના સંદર્ભમાં. ૧૩મી એજીએમની નોટીસ અને ૧૩મ

ગુવારા કાર્યામાં કાર્યું હતા અને કરાના વારાના નાગના હતા. વાર્ષિક અદેવાલની નકલો રૂપ ઓગસ્ટ, રુગરડ ના રોજ કંપની /કિપોઝીટરીઝ પાસે સભ્યો/લાભાકો માલિકો તરીકે નોંધાયેલા અને જેમના ઇ-મેલ આઇડી કંપની/ડીપોઝીટરીઝ પાસે નોંધાયેલા દ

તેવા શેરધારકોને માત્ર ઇ-મેઇલ દ્વારા જ મોકલવામાં આવશે. એજીએમની નોટિસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.suil.in અને બંને રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ્સ

જે સભ્યો ક્રીઝીકલ રૂપમાં શેર ધરાવે છે અને જેમનું ઇ-મેઇલ સરનામું કંપનીમાં નોંધાયેલ નથી, તેઓ પોતાનું ઇ-મેઇલ સરનામું વિનંતી પત્રની સ્કેન કરેલી નકલ નામ, ફ્રોલિયો નંબર અને સંપૂર્ણ સરનામું,

પેનકાર્ડની સ્વયં પ્રમાણિત સ્કેન કરેલી નકલ અને કંપનીમાં નોંધાયેલા સભ્યના સરનામાના સમર્થન

આધારકાર્ક, ફાઇવિંગ લાઇસન્ટર, ચૂંટણી ઓળખકાર્ક, પાસપોર્ટ જેવા કોઈ દરતાવેજની સ્વયં પ્રમાણિત, સ્કેન કરેલી નકલ સાથે કંપનીને cs@sepower.in અથવા આરટીએને ઇ-મેઇલ દ્વારા

ramap@alankit.com પર મોકલીને નોંધણી કરાવી શકે છે. કીમેટ ફોર્મમાં શેર ધરાવતા સભ્યો તેમન ઇ-મેઇલ સરનામાને તેમના કિપોઝિટરી સहભાગી પાસે અપકેટ કરાવી શકે છે.

રરમી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ડીમટીરિયલાઈઝડ સ્વરૂપમાં અથવા ફિઝિકલ સ્વરૂપમાં શેર ધરાવલ

સભ્યોને ૧૩મી એજાએમમાં ભાગ લેવાની અને ઠરાવો પર ઇલેક્ટોનિક રીતે પોતાનો મત આપવાની ૧૩મી

એજીએમબી નોટીસમાં દર્શાવ્યા મુજબ તક મળશે અને સભ્યોને ૧૩મી એજીએમમાં દાજરી આપવાની અને ઇ વોટીંગ કરવાની રીત એજીએમની નોટિસમાં આપવામાં આવી છે. ૧૩મી એજીએમમાં ભાગ લેવા

અને ઇલેક્ટ્રોનિક રીતે મત આપવા માટે લોગ ઇન અધિકાર પત્રો ઇમેઇલ દ્વારા સભ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે સભ્યોને ઇ-મેઇલ ન મળે અથવા જેમના ઇ-મેઇલ કંપની/ડિપોઝિટરી સहભાગી સાથે નોંધાયેલા નથી તેઓ એજીએમની નોટીસમાં આપેલી સૂચનાઓને અનુસરીને લોગ ઇન

બોર્ડ ઓક ડાયરેકટરના ઠકમર્થ

(કંપની સેક્રેટરી)

www.bseindia.com અને https//www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.

આથી રસ ધરાવતી સંસ્થા/ઇજારદાર/વ્યકિતઓને

આ વિભાગ દ્વારા નક્કી થયેલ શરતો મુજબ

નાયબ વન સંરક્ષક

SoUADTGA, એકતાનગર

કેવડીયા

પુરઝડપે જતા હતા. દરમીયાન એકટીવા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

રાજપીપળા,તા.૩૧

તાલુકાના શંભુનગર ચોકડી આગળ

બે બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું

મોત નિપજ્યું હતું જ્યારે ત્રણને ઇજા

કામગીરી કરવાની રહેશે.

તારીખ

:-30 /o C/3053

સાથે વેંચાણે લેતાં **આથી નોટીસ આપવામાં આવે છે કેઃ**

હાજરીમાં આચોજિત કરવામાં આવશે.

(માહિલી/નર્મદા/૨૨૪/૨૦૨૩-૨૪)

:- એકતાનગર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા

તો બીજી બાજુ નાંદોદના ધારાસભ્ય ડો. ખેડુતોના ઉભા પાકને બચાવવા માટે સિંચાઈ

હોવાથી પાકને સહિતના અનેક પ્રશ્નો ખેડુતોમાં ઉઠી રહ્યા છે. જિલ્લાના

વડોદરા મહાનગરપાલિકા

આકારણી શાખા વર્ષ:૨૦૨૩-૨૪ના આકારણી રજસ્ટર પ્રસિધ્ધ કરવાની જાહેર નોટીસ

www.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા હૃદ વિસ્તારમાં આવેલ ઉત્તર ઝોનના હૃદ વિસ્તારમાં આવેલી તમામ રહેણાંક, બીન રહેણાંક, ઔદ્યોગીક એકમો ચઠીતની તમામ મિલકતોના અને ૨૦૨૩-૨૪ના વર્ષનાં આકારણી રજસ્ટર ધી ગુજરાત પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-૧૯૪૯ના પરિશિષ્ટ 'ક' ના પ્રકરણ-૮ ના નિયમ ૯ તથા નિયમ ૧૩ થી ૧૬ મુજબ પ્રસિધ્ધ કરવામાં

ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ મુજબ મિલકતનો સામાન્ય કર આકારવા અંગેના વિવિધ પરિબળો તેમજ શિક્ષણ ઉપકર, પાણી કર, તથા કન્ઝરવન્સી અને સુએઝ ટેક્ષ, હાયર ટેક્ષ વિગેરેની વિગતો દર્શાવતા ઉત્તર ઝોનનાં (વોર્ડ નં. 09.02.03.09 અને 93) હદ વિસ્તારમાં આવેલી રહેણાંક. બીનરહેણાંક અને ઔદ્યોગિક એકમોની તમામ મિલક્તોનાં અને ૨૦૨૩-૨૪નાં વર્ષના આકારણી રૂજરરર તા.૦૧-૦૯-૨૦૨૩ થી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ રિજસ્ટર માં દાખલ કરેલી વિગતો અને નોંધો, કચેરીનાં કામકાજનાં દિવસોમાં અવારનાં ૧૦.૩૦ થી ૧.૦૦ તથા ૧.૩૦ થી આંજના ૫.૦૦ કલાક સુધી અબંધિત વહીવટી વોર્ડની કચેરીમાં જેવા મળશે. આકારણી રજિસ્ટરમાં નોંધવામાં આવેલ વિગતો બાબતે જે કોઇ વાંધો હોય તો લેખિત વાંધા અરજ તા.૧૫-૦૯-૨૦૨૩સુધીમાં નિયત કરેલા ફ્રોમેમાં કે સાદા કાગળમાં સંબંધિત વહીવટી વોર્ડ ની કચેરીમાં આપી તેની પહોંચ મેળવી લેવી અથવા તમારી નકલ ઉપર સદી સિક્કા કરાવી લેવાના રહેશે.

વાંધા અરજ અંગેનું ફોર્મ નિયત કિંમતે થી વોર્ડ કચેરી ખાતેથી મળી શકશે તેમજ અરજદાર સાદા કાગળ પર પણ વાંધા અરજ કરી શકશે.

સદર બઠેરાત સબંધિત વધુ વિગતો/બણકારી/સમજ મેળવવા કચેરી નાં કામકાજ નાં અમયમાં અંબંધિત વઠીવટી વોર્ડની કચેરીનો અંપર્ક કરવા તમામ કરદાતાઓને જણાવવામાં આવે છે.

પી.આર.ઓ.નં. ૭૧૮ /૨૦૨૩-૨૪

મ્યુનિસિપલ કમિશનર

તિલકવાડા-આમલેથા પોલીસે રૂ.૭૫ હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડયો માંથી અંગ્રેજી દારૂ અને બિયર મળી કિ.રૂ. ૧૩,૫૦૦/- તથા એક્ટીવા

રાજપીપળા,તા.૩૧

તિલકવાડા પોલીસે ગણસીંડા ગામથી રસીકભાઇ ગણપતભાઇ (રહે. ગણસિંડા રહેશાક ઘરના પાછળના ભાગે પાકી ઓરડીમા એક લોખંડની તિજોરી

દારૂ ભરેલ ક્વાટરીયા નંગ- ૧૩૫ ભાગી ગયો હતો.

કિ.રૂ. ૨૬,૫૭૫/- નો મુદ્દામાલ ૫કડી સ્કુટરની કિ.રૂ. ૩૫,૦૦૦/- માં ગુનો દાખલ કર્યો છે જ્યારે બીજો ગુનો 🛮 ભરી લઇ છટવાડા તરફથી આવતા મહુડીપાડા ત્રણ રસ્તા નજીક પાસે પોલીસ દ્વારા રોકવા જતા દૂરથી તા.તિલકવાડા જી.નર્મદા) પોતાના બન્યો એકટીવા ઉપર એક પ્લા.ના પોલીસને જોઇ મુદ્દામાલ કુલ રૂપિયા થેલામાં ભારતીય બનાવટના વિદેશી ૪૮,૫૦૦/- નો તે જગ્યાએ મુકી

કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ CIN: L24231GJ1988PLC011652 રજી. ઓફિસઃ બ્લોક નંબર ૩૫૫, મંજુસર કુનપાડ રોડ, ગામઃ મંજુસર, તાલુકોઃ સાવલી, વડોદરા – ૩૯૧ ७७૫

टेसिक्रोनः ०२५५–२६८११६५ । वेजसाधटः www.cscpl.com । ध–भेधसः investor.relations@cscpl.com સભ્યોને આથી જણાવવામાં આવે છે કે કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ (કંપની) ના સભ્યોની ૩૪ મી (ચોત્રીસ મી) વાર્ષિક સાધારણ સભા (''એજીએમ'') ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૩ ને ગુરુવારે ૧૧:૩૦ વાગ્યે વિડીયો કોન્કરન્સિંગ (VC) / અન્ય ઓડિયો–વિઝ્યુઅલ મીન્સ (OAVM) દ્વારા ચોજવામાં આવશે. આ એ.જી.એમ. મિનિસ્ટરી ઓફ કોર્પોરેટ એફેરસ ના તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને ૫ મે, ૨૦૨૦ ના સામાન્ય પરિપત્ર નંબર અનુક્રમે ૧૪/૨૦૨૦, ૧७/૨૦૨૦ અને ૨૦/૨૦૨૦ તથા આ સંદર્ભે જારી કરાચેલ અનુગામી પરિપત્રો તાજેતરની તારીખ ૨૮ કિસેમ્બર ૨૦૨૨ ના સામાન્ય પરિપત્ર નંબર ૧૦/૨૦૨૨, અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ એફ ઇન્ડિયા ના તારીખ ૧૨ મે, ૨૦૨૦ અને ૫ જાન્યુઆરી , ૨૦૨૩ ના સામાન્ય પરિપત્ર નંબર અનુક્રમે SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 અને SEBI/HO/CFD/POD-2/

PCIR/2023/4 ના પાલન અનુસાર અને કંપનીઝ એકટ, ૨૦૧૩ અને એંસ.ઇ.બી.આઇ. (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ અને કિસ્કોઝર રિકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (''લિસ્ટીંગ રેગ્યુલેશન્સ'') ના પાલન અનુસાર યોજવામાં આવશે. ઉપરોક્ત પરિપત્રો અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩ માટેના વાર્ષિક અહેવાલ સાથે એ.જી.એમ. ની નોટિસ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા તે સભ્યો નેજ મોકલવામાં આવશે જેમના ઇ–મેલ સરનામા કંપની/ ડિપોઝિટરીઝમાં નોંધાયેલા હશે. વાર્ષિક અહેવાલ સાથે એ.જી.એમ. ની નોટિસ કંપનીની વેબસાઇટ (www.cscpl.com) અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ- બી.એસ.ઇ. લિમિટેડ (www.bseindia.com), નેશનલ સ્ટોક એક્સચેન્જ એફ ઇન્ડિયા લિમિટેડ (www.nseindia.com) પર પણ ઉપલબ્ધ રહેશે. એ.જી.એમ. ની નોટિસ, રિમોટ ઇ-મતદાન સુવિધા પૂરી પાડવા માટેની એજન્સી એટલે કે એન.એસ.ડી.એલ ની વેબસાઇટ (www.evoting.nsdl.com) પર પણ ઉપલબ્ધ રહેશે.

સભ્યોએ એ.જી.એમ. ની સૂચનામાં દર્શાવેલ બિઝનેસ પર રિમોટ ઇ-વૉટિંગ દ્વારા અથવા મીટિંગ દરમિયાન ઇ-વૉટિંગ સિસ્ટમ દ્વારા ઇલેકટ્રોનિક રીતે તેમનો મતદાન કરી શકે છે. જે સભ્યો ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવે છે અથવા જેમણે કપંની / કિપોઝિટરીઝમાં તેમના ઇમેઇલ સરનામાં નોંધાવ્યા નથી તેઓ એ.જી.એમ. ની નોટિસમાં આપવામાં આવેલી સૂચનાઓને અનુસાર ઇલેકટ્રોનિક રીતે મતદાન કરી શકે છે.

જે સભ્યોએ કંપની/ડિપોઝિટરીઝમાં તેમના ઇમેઇલ સરનામાં નોંધાવ્યા નથી તેઓ નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩ માટેના વાર્ષિક અહેવાલ અને ઇલેકટ્રોનિક રીતે મતદાન કરવા લોગઇન વિગતો મેળવવા માટે નીચે જણાવેલ પ્રક્રિયા हેઠળ તેમના ઇમેઇલ સરનામાં નોંધાવવાના રहેશેઃ

અ. ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો માટેઃ કૃપા કરીને નીચે મુજબના દસ્તાવેજો કંપનીના ઇ–મેઇલ સરનામા investor.relations@cscpl.com પર મોકલવા :

- ૧. હસ્તાક્ષરિત વિનંતી પત્રની રકેન કોપી જેમાં તમારો ફોલિયો નંબર, સંપૂર્ણ સરનામું અને નોંધણી કરાવવા માટેનું ઇમેઇલ સરનામાનો ઉલ્લેખ
- ૨. શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ)
- 3. પાનકાર્ડની સ્કેન કરેલી સ્વપ્રમાણિત નકલ, અને
- ૪. સભ્યના નોંધાયેલા સરનામાને ટેકો આપતા કોઇપણ દસ્તાવેજ

બ. ડીમેટ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો માટેઃ કૂપા કરીને તમારા સંબંધિત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ મારફતે તમારું ઇમેઇલ સરનામું અપડેટ કરાવવું.

કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ વતી શાહિલકમાર કાપટેલ

કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓક્સિર સભ્યપદ નં. એ પરર૧૧

તારીખ: 31/0८/२०२3 શ્રી ગાયત્રી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિમીટેડ

લક્ષ્મીનારાયણ ચેમ્બર્સ, સરદારભવન મેઈન રોડ, શાલીમાર ચેમ્બર્સની સામે, જ્યુબીલીબાગ પાછળ, વડોદરા-૩૯૦૦૦૧. ફોન :૨૪૨૫૪૬૧

વાર્ષિક સાધારણસભા અંગે

શ્રી ગાયત્રી ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી. ની ચાલીસમી વાર્ષિક સાધારણ સભ તા.૧૨/૦૯/૨૦૨૩ ને મંગળવારના રોજ મંડળીના કાર્યાલયમાં સાંજે ૩–૩૦ કલાકે રાખવામ આવેલી છે. તો તે પ્રસંગે દરેક સભાસદે પધારવા વિનંતી છે. વાર્ષિક અહેવાલ મંડળીર્ન ઓફીસેથી મળશે. વાર્ષિક અહેવાલમાં જણાવેલ કાર્યસચી પ્રમાણે કામો હાથ ધરવામાં આવશે.

તા. ૨૯/૦૮/૨૦૨૩ સ્થળ : વડોદરા

વ્યવસ્થાપક મંડળના આદેશથી ભરતભાઈ ડી. ભક (મેનેજીંગ ડાયરેક્ટર)

Tender Notice/Advertisement GD/T-M/2023-24/492

The Panchmahal District Co-operative Milk Producer's Union Ltd, Lunawada Road, P. B. No. 37, Godhra - 389001, Dist: Panchmahal (Gujarat), INDIA, (O) 02672-261782 to 84, Fax: 02672-260327 invites bid for as per below from registered contractor with relevant experience for Supply & Service in related field.

Sr.No.	Description	Particulars		
1.	Name of work	Providing and construction of German Dome Mandap for Honorable Union Home Minister Inauguration Function with VIP/VVIP sitting, AC lounge, LED Display, Various Stages, Flower Decoration, electrification, CCTV, Air Conditioning, Fire fighting system, Videography, Photography, Live streaming, All Govt liasioning and other related works at Ujjain site.		
2.	Time limit	AS PER TENDER		
3.	Cost of Tender	Rs. 4,000		
4.	E.M.D.	Rs. 1,00,000		
5.	Date of Bid Sale start	DT. 1/9/2023 AT 10:00 AM		
6.	Date of Bid Sale stop	DT. 4/9/2023 AT 5:00 PM		
7.	Last date of Bid submission to this office	DT. 6/9/2023 Up to 05.00 PM		
8.	Place for purchase of tender document	Godhra		
9.	Validity of tender	90 days		
	any or all tenders or accept any tender			
without assigning any reason thereof. MANAGING DIRECT				



અકોર્ક સિનર્જ લીમીટેડ

CIN No. L45200GJ2014PLC079847

રજીસ્ટર્ક ઓફિસ : ૩૦૨, સાઈન પ્લાઝા, નટુભાઇ સર્કલ, રેસકોર્સ, વઠોદરા-૩૯૦૦૦૭ ફોન : ૦૨૬૫-૨૩૫૬૮૦૦ ફેક્સ : ૦૨૬૫-૨૩૫૬૮૦૦ $We b site: www. accord synergy. com \ Email: in fo@accord synergy. com$

સચના આપવામાં આવે છે કે એકોર્ડ સિનર્જી લીમીટેડ (કંપની)ના સભ્યોની નવમી વાર્ષિક સામાન્ય સભા સપ્ટેમ્બર. ૨૦૨૩ના ૨૯મી તારીખ, શુક્રવારે, બપોરે ૧ઃ૩૦ વાગે ચોજાશે. (IST). કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર નેંબર ૧૦/૨૦૨૨ તા. ડીસેમ્બર ૨૮, ૨૦૨૨ સાથે વાંચેલા પરિપત્રો જાન્યુઆરી ૧૩ ૨૦૨૧, એપ્રિલ ૮, ૨૦૨૦, ૧૩ એપ્રિલ ૨૦૨૦ અને ૫ મે ૨૦૨૦ અને ૫ મે ૨૦૨૨ના પરિપત્ર મુજબ, એ.જી.એમ વિડીઓ કોન્ફોરન્સ (વી.સી) / અન્ય ઓડિઓ વિઝયુઅલ મિન્સ દ્વારા યોજવામાં આવી રહયું છે એ.જી.એમ.ની નોટીસમાં નકકી કર્યા મુજબ ધંધાનો વ્યવહાર કરવા માટે નેશનલ સીકચોરીટીઝ ડીપોઝીટરીઝ લિમીટેડ (એન.એસ.ડી.એલ.) દ્વારા (ઓએવીએમ) સુવિધા આપવામાં આવી રહી છે ઇલેકટ્રોનિક રૂપે એજીએમમાં જોડાવા માટેની સુચનાઓ એજીએમની સુચનામાં આપવામાં આવી છે

ઉપર જણાવેલ એમસીએના પરિપત્રો તેમજ સેબી દ્વારા આપવામાં આવેલ ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજના પરિપત્ર અન્વચે સભ્યોનું ઘ્યાન દોરવામાં આવે છે કે ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ સમાપ્ત થચેંલા વર્ષનો વાર્ષિક રીપોર્ટ આજરોજ ફકત એવા સભ્યોને ઇલેકટ્રોનિકલી મોકલવામાં આવેલ છે કે જેઓના ઇમેઇલ આઇ.ડી. કંપનીના રજીસ્ટ્રાર કર ડીપોઝીટોરી પાર્ટીસીપન્ટસમાં નોંધાવેલ છે. કંપનીના રજીસ્ટ્રાર, ડીપોઝીટરી સહભાગી, (ડી.પી.) માં જે સભ્યોએ પોતાનો ઇમેલ આઇ.ડી. નોંધાવ્યો નથી તે કૃપા કરીને તેમના ડીપી અથવા આર.ટી.એ. લિંક ઇન ટાઇમ સર્વિસીસમાં www.linkintime.co.in પર નોંધણી કરાવવા વિનંતી છે.

કંપનીઓ અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૯૧ હેઠળ પણ નોટીસ આપવામાં આવી છે કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમીનીસ્ટેશન) નિયમો ૨૦૧૪ના નિયમ ૧૦ સાથે વાંચવામાં આવે છે કે કંપનીના સભ્યોની રજીસ્ટર શેર ટ્રાન્સફર બુકસ શનિવાર , ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩થી બંધ રહેશે અને એજીએમ. ના હેતુ માટે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ને ગુરૂવાર (બંન્ને દિવસ સહિત) કંપની એ.જી.એમ. સ્ચનામાં જણાવેલ તમામ વ્યવસાચિક વસ્ત્ઓ પર મત આપવા માટે એન.એસ.ડી.એલ. દ્વારા પુરી પાંડવામાં આવતી ઇલેકટ્રોનિક મતદાન સેવાઓ દ્વારા તેના સભ્યોને રીમોટ ઇ-વોટીંગની સુવિધા પ્રદાન કરશે. શેર ધરાવતા અને સભ્યોના રજીસ્ટરમાં નોંધાયેલા સભ્યો અથવા ડીપોઝીટરી દ્વારા જણાવવામાં આવેલા લાભકારક માલીકોના રજીસ્ટ્રરમાં નોંધાચેલા સભ્યો એટલે કે ગુરૂવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩, ઇ –મતદાનનો હકકદાર રહેશે. રીમોટ ઇ–વોટીંગ મંગળવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૯–૦૦ વાગે (IST) થી શરૂ થશે અને ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ને ગુરૂવારે ૫–૦૦ વાગે (IST) પર સમાપ્ત થશે. ત્યારબાદ ઈ–મતદાન અક્ષમ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કે જે કંપનીના શેરો મેળવે છે અને એજીએમ નોટીસ મોકલ્યા પછી સભ્ય બને છે અને સમય પુર્ણ થયા બાદ શેરહોલ્ડર કરે છે તે યુઝરે આઇ.ડી. અને પાસવર્ક evoting@nsdl.co.in પર વિનંતી મોકલીને મેળવી શકે છે અથવા જો પહેલેથી જ એનએસડીએલ સાથે ઇ–વોટીંગ માટે નોંધાચેલ છે તો હાલના વપરાશકર્તા આઇ.ડી. અને પાસવર્ડનો ઉપયોગ મતદાન કરવા માટે કરી શકાય છે.

ઈજી મતદાન માટેની સુવિધા એજીએમ પર ફકત તે જ સભ્યોને આપવામાં આવશે કે જે ઓવીસી/ઓએવીએમ દ્વારા એજીએમમાં હાજર હોંચ અને પોતાનો મત ન આપ્યો હોય. એજીએમની સુચના અને વાર્ષિક અહેવાલ કંપનીની www.accordsynergy.com વેબ સાઇટ, સ્ટોક એક્સચેન્જ www.nseindia.com ની વેબસાઇટ અને www.evoting.nsdl.com પર એનએસડીએલની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ઇ–વોટીંગ સબંધિત કોઇપણ પ્રશ્નોના કિસ્સામાં, સભ્યો શેર હોલ્ડરો માટે વારંવાર પુછાતા પ્રશ્નો (એફએકયુ)નો સંદર્ભલો અને www.evoting.nsdl.com ના કાઉનલોક વિભાગ પર ઉપલબ્ધ શેર હોલ્કરો માટે ઇ–વોટીંગ વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા ટોલફ્રી નંબર 18001020990/1800224430 પર કોલ કરી શકે છે. અથવા એન.એસ.ડી.એલ.ને evoting@nsdl.co.in પર વિનંતી મોકલો. ફોર એકોર્ડ સિનર્જી લીમીટેડ

બોર્ડ ઓફ ડિરેકટર્સ વતી સ્થળ : વકોદરા

તારીખ : ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ સહી/- કિર્તી ભાવેશ ચૌહાણ (કંપની સેક્રેટરી) PDCMPUL - GODHRA



સ્થળ : વડોદરા







